



## પ્રકરણ - ૩૧

## સ્વાસ્થ્ય સંભાળની આવડતો



સ્વાસ્થ્ય સંભાળની કેટલીક આવડતો અને નુસ્ખા પેઢી દર પેઢી શીખવાના મળે છે.  
તમારી આવડત તમારી દીકરીઓને જરૂર શીખવો.

### વિષયસૂચિ :

- |   |   |
|---|---|
| ૧.૦ ચેપ અટકાવવો                                     | ૫.૦ સ્ત્રી જનનાંગોની તપાસ                         |
| ૨.૦ ઉષણતામાન, નાડીના ધબકાર અને<br>શ્વાસનો દર માપવાં | ૬.૦ દાઢેલાની સારવાર                               |
| ૩.૦ લોહીનું દબાણ અથવા રક્તચાપ<br>(બલદ પ્રેશર)       | ૭.૦ બેભાન દર્દીને પ્રવાહી આપવાની રીત              |
| ૪.૦ પેટ અને પેઢુંની તપાસ                            | ૮.૦ ઈજેક્શન આપવાની રીત                            |
|   | ૯.૦ અલર્જ્ઝ રીએક્શન કે શૉકની સારવાર<br>કરવાની રીત |

## સ્વાસ્થ્ય સંભાળની આવડતો

આ પુસ્તકમાં ઘણી જગ્યાએ અમે એવી કેટલીક આવડતોનો ઉત્તેખ કર્યો છે, જેનાથી બિમાર માણસની સારામાં સારી સારવાર તમે કરી શકો. આ વિભાગમાં આ કુશળતાઓ અંગે સંવિસ્તર માહિતી આપી છે અને તમે એ કેવી રીતે શીખી શકો તે પણ આપ્યું છે.

તમને કદાચ એવું લાગે કે, દર્દનિ રોગાણુના ચેપથી બચાવવા ઈજેક્શન આપવા, જીવનરક્ષક પ્રવાહી ચડાવવું કે શારીરિક તપાસ કરવી તે એક ડૉક્ટર કે નર્સનું કામ છે. પણ ના, કોઈ પણ વ્યક્તિ થોડુંક ધ્યાન હેતુ આ બધું કુશળતાથી શીખી શકે છે. આ આવડતો તમને સમાજમાં એક વિશેષ સ્થાન પણ અપાવે છે અને તમે બીજને મદદ કરવાની તમારી ઈરછા પણ પૂર્ણ કરી શકશો.

### ૧.૦ ચેપ અટકાવવો :

વિવિધ રોગાણુના ચેપને લીધે અનેક પ્રકારની માંદગી આવે છે. નબળા, બિમાર અને ઈજાગ્રસ્ત લોકોને ચેપ બહુ જલ્દી લાગે છે. તેથી તેમની બિમારી વકરી જથું છે અને સારવાર વધુ અધરી બને છે. વળી બીજની સારવાર કરતા કરતાં તમને તેનો ચેપ ના લાગે એની કાળજી કેવી રીતે લેવી તે પણ તમારે શીખી લેવું પડે. ચેપનું કારણ નરી આંખે ન દેખાતા રોગાણુ - સુક્રમ જીવો (જીવાણુ, વિષાણુ અને અન્ય) છે. સામાન્ય રીતે તંદુરસ્ત માણસના મોં, આંતરડા, ત્વચા, જનનાંગોમાં રોગાણુ હોય છે જ. આ જીવો સામાન્ય રીતે તેને નુકસાન નથી કરતા પણ જે તે માંદા માણસને લાગી જથું તો તે વધુ બિમાર થઈ જથું છે. આ રોગાણુ માંદા માણસની સારવારમાં વપરાતા સાધનો પર પણ રહે છે અને તે સાધનો બરાબર જંતુરહિત કર્યા વગર વાપરવામાં આવે તો તે બીજ માણસને પણ લાગી શકે છે. તમે અહીં આ પાઠમાં આપેલા સૂચનોનો ઉપયોગ કરી ચેપ અટકાવતા શીખી શકો છો.

### હાથ ધોઈને ચોખ્ખા કરો :

માંદા માણસની સારવાર કરતા પહેલાં તમારા હાથની ચામડી પર રહેલા રોગાણુ સાફ કરવા માટે હાથ બરાબર ધૂઓ. તે માટે હાથ ભીના કરી સાબુ કોણી સુધી લગાવીને બરાબર ધસો. ત્યાર બાદ ખૂબ પાણીથી ધોએલા હાથ બીજે કશે લગાડશો નહિ. ધોએલા હાથને સૂક્વવા માટે નેપકીન/કપડાનો ઉપયોગ ન કરતાં હવામાં જ સૂકાછ જવા હો. નીચે મુજબની કોઈ પણ સારવાર વખતે આ પ્રમાણે હાથ ધોવા જોઈએ.



- \* સૂવાવડ કરાવતા પહેલા અને પછી
- \* ધા ઉપર ડ્રેસીંગ કરતા પહેલા અને પછી
- \* ઈંજેક્શન મૂકતાં પહેલા અને પછી
- \* વાઢકાપમાં મદદ કરતા પહેલા અને પછી
- \* યોનિમાંથી વહેતા લોહી, પેસાબ, ઝાડો કે અન્ય પ્રવાહીને અડક્યા પછી.
- \* શરીરની અંદરની તપાસ માટે વાપરેલા મોંન કાઢ્યા બાદ.




નોંધ : હાથ ધોવા માટે બનતા સુધી નળમાંથી વહેતું ચોખ્ખુ પાણી વાપરવું તે શક્ય ના હોય તો ચોખ્ખુ પાણી ખૂબ વાપરવું. હાથ ધોવા માટે સાખુનો ઉપયોગ કરો. સાખુ લગાડ્યા પછી તેના ફીણને તમારા કોણી સુધીના આખા હાથ પર ચારેબાજુ ફેલાવો અને ઓછામાં ઓછું ૩૦ વાર ધસો. કોઈ બ્રશ કે પોચી સળીથી નખમાં ભરાયેલો મેલ સાફ કરો. ત્યાર બાદ આખા હાથ ધોઈ નાંખો. એકવાર વાપરેલું પાણી ફરીથી ના વાપરશો.

હાથ ધોયા પછી કયાંય અડકશો નહિ. કોરા થયા પછી જે જગ્યાએ જરૂરી છે ત્યાં જ અડકવું, બીજે કશો નહિ.

### સાધનો જંતુરહિત કરવા

સાધનોને ચોખ્ખા કરવા માટે ફક્ત ધોવાનું જ નહીં પણ જંતુરહિત કરવા માટે વિશેષ પદ્ધતિનો ઉપયોગ કરો. તેનાથી સાધનોમાં લાગેતા બધા જીવાણુ વગેરે નાશ પામે છે.

- \* ચામડી પર છુંદળા છુંદાવતી વખતે, કાન કે નાક કોચવા માટે અથવા અન્ય કોઈ વાઢકાપ કરતી વખતે સાધન જંતુરહિત કરવું જોઈએ.
- \* ઈંજેક્શન આપતી વખતે સોય સીરીન્ઝ વગેરે જંતુરહિત કરવા જોઈએ.
- \* સૂવાવડમાં નાળ કાપવાનું સાધન જંતુરહિત કરવું જોઈએ.
- \* સૂવાવડ, ગર્ભપાત કે અન્યથા અંદરથી યોનિ તપાસ કરતી વખતે વપરાતા સાધનો જંતુરહિત કરવા જોઈએ.
- \* ગુદા વાટે પ્રવાહી ચડાવતી વખતે વપરાતા સાધનોને જંતુરહિત કરવા



## સ્વારથ્ય સંભાળની આવડતો

### જંતુરહિત કરવા માટેની રીત :

નીચે જણાવેલા ઉપયોગમાંથી પ્રથમ બે પગથિયા કોઈપણ સાધનને વાપર્યા પછી તરત જ અમલમાં લેવાના છે. ત્રીજી પગથિયામાં જણાવેલી માહિતી કોઈપણ સાધન વાપરતાં પહેલાં ઉપયોગમાં લેવાની છે.

- સાધનો પલાળવા : સાધનોને ૧૦ મિનિટ સુધી બ્લીચ (૦.૫%) વાળા પાણીમાં પલાળી રાખો. સાધનો પર લોહી કે અન્ય પ્રવાહી સૂકાઈ ન જાય તેની કાળજી રાખો. એકવાર બનાવેલું પાણી ૨૪ કલાક પછી નાંખી હો. બીજે દિવસે બીજું બનાવો.



૦.૫% બ્લીચનું પ્રવાહી કેવી રીતે બનાવશો.


જે તમારા મૂળ બ્લીચમાં

૨% કલોરીન મળે છે એવું લઘ્યું હોય તો ૧ ભાગ બ્લીચમાં ઉભાગ પાણી નાંખો

૫% કલોરીન મળે છે એવું લઘ્યું હોય તો ૧ ભાગ બ્લીચમાં ૮ ભાગ પાણી નાંખો.

૧૦% કલોરીન મળે છે એવું લઘ્યું હોય તો ૧ ભાગ બ્લીચમાં ૧૮ ભાગ પાણી નાંખો.

દા.ત. ૫% બ્લીચનો ૧ કપ લેવો તેમાં ૮ કપ પાણી નાંખવું.



- સાધનો ધોવા સાબુના પાણી અને બ્રશની મદદથી ધસીને સાધનોને ઝૂબ પાણીમાં ધોઈ નાંખો. તેમ કરતા તમને વાગી ના જાય તેનું ધ્યાન રાખો. ધોતી વખતે હાથ પર રબર કે પ્લાસ્ટિકના મોન્ઝ પહેરો.



- જંતુરહિત કરવા માટે ૨૦ મિનિટ સુધી ઉકળતા પાણીમાં ઉકળવા દેવા. સાદા પ્રેશર ફૂકરમાં ૨૦ મિનિટ સુધી રાખવાથી સાધનો જંતુરહિત બને છે. ઢાંકણાવાળા વાસણામાં પાણી મૂકી સાધનોને ઉકાળો. પાણી ઉકળવા માંડે એટલે ઘડિયાળમાં જેઠ ૨૦ મિનિટ સુધી ઉકાય્યા કરો. પહેલેથી પૂરતું પાણી મૂકવું જરૂરી છે. આમ જંતુરહિત થયેલા સાધનોનું પાણી કાઢી નાંખી અડક્યા વગર સૂકાઈ જવા હો અને બંધ ડબ્બામાં મૂકી રાખો.




સામાન્ય રીતે ભીના સાધનો પર કાટ આવે છે તેથી કપડામાં વીઠીને વરણમાં રાખીને સાધનો જંતુરહિત કરવા વધુ સાંદું છે. જંતુરહિત કર્યા પછી સાધનોનું કપડામાં વીઠાયેલું પડીકું એમ જ રાખો અને કોરા ચોખ્ખા ડભામાં મૂકી રાખો.




### સોય-સિરીંજ જંતુરહિત કરવા.

ઢંજેકશન વાપર્યા પછી તરત તેમાંથી ત્રણ ચાર વાર પાણી પસાર કરો અથવા સાખુ વાળું પાણી સિરીંજમાં લઈને 3-4 પિચકારી મારીને સાફ કરો. ત્યાર બાદ બધા ભાગ છૂટા કરીને ઉપર જણાવ્યા ગ્રમાણે જંતુરહિત કરો. જે એકવાર વાપરીને ફેંકી દેવાના સોયસીરીંજ વાપરતા હો તો પણ 3-4 વાર સાખુવાળા પાણીમાં પિચકારી કરીને પછી તેમને બાળી મુકો અથવા તોડીને ખૂબ ઉંડે દાટી હો. તેને ગમે ત્યાં ફેંકવાથી આજુભાજુ રમતા બાળકોના અથવા કચરો વીણનારા બાળકો/સ્ત્રીઓના હાથમાં જય છે અને તેમને ચેપ લાગે છે.



### મોંન સાફ કરવા :

મોંન તમને અને દર્દીને બન્ને જીવાણુ કે અન્ય ચેપ સામે રક્ષણ આપે છે. દર્દીની વિવિધ પ્રકારની સારવાર વખતે તેના લોહી, પરુ, યોનિ કે મુખ વગેરે ભાગના પ્રવાહીઓ વગેરેનો સીધો સ્પર્શ ટાળવા માટે મોંનનો ઉપયોગ થાય છે.




તમારી પાસે મોંન ન હોય તો પ્લાસ્ટીકની ચોખ્ખી કોથળીનો ઉપયોગ કરો. સામાન્ય રીતે તે ચાલે પણ જે તમારે સુવાવડમાં યોનિ તપાસ કરવાની હોય કે વાઢકાપમાં કામ કરવાનું હોય તો સારા જંતુરહિત કરેલા મોંન વાપરો. મોંનને ઊંઘા કરીને જંતુરહિત કરવા મૂકેલા હોય છે. મોંન પહેરતી વખતે ધ્યાન રાખો કે દર્દીના શરીરને જે ભાગ અડકવાનો છે તેની પર તમારો હાથ ના અડી જય કે તે બીજુ કોઈ જગાએ અડકી ના જય. મોંનને પણ જંતુરહિત કરવા માટે ઉકાળવા કરતા વરણમાં ગરમ કરવા વધારે સારા છે.

## સ્વારથ્ય સંભાળની આવડતો

પહેરતી વખતે મોજંનો બહારનો ભાગ ક્યાંય અડકી ના જય તેની કાળજી રાખો.

અહીંથી હાથ નાંખો



આ ભાગને અડવું નહીં. તે કોઈ જગ્યાએ સ્પર્શી ના જય તેની કાળજી રાખો.

### કપડાનું ડ્રેસીંગ :

જંતુરહિત પાટાને બદલે તમે ધરના ચાખ્ખા, ધોઅેલા, પાતળા અને સુતરાઉ કાપડના કટકાનો ઉપયોગ કરી શકો છો. પણ તે બરાબર ધોઈને તડકે સૂકવેલા હોવા જેઠાંથે. શક્ય હોય તો વરણમાં જંતુરહિત પણ કરી લેવા. એક વાર ચોખ્ખા કર્યા પછી આ કપડાને જમીન પર ના મૂકવું કે તેની ઉપર ધૂળ, કચરો, માખી કે અન્ય જીવ-જંતુ ના બેસે તેની કાળજી લેવી.

**ચાદ રાખો :** કોઈ પણ કપડું કે મોજું જેનાથી લોહી કે અન્ય પ્રવાહી લૂછયું હોય તેને બાળી દો. અથવા બીજા લોકોના હાથમાં ના જય તેમ ફેંકી દેવું, તેને દાટી દેવા કે બાળી નાંખવા એ સારો ઉપાય છે. પ્રાણીઓ કે બાળકો કે સફાઈ કામદારોના હાથમાં આવા વાપરેલા અને શરીરના પ્રવાહીઓ લાગેલા બિનઉપયોગી સાધનો જેવા કે, ફાટેલા મોજં, ફેંકી દેવાની સોય, સિરીંજ ડ્રેસીંગનું રૂપ, પાટા, કપડા, માસિક પેડ વગેરે ના જય તેની ખાસ કાળજી લેવી જેઠાંથે.


### ૨.૦ શરીરનું ઉષણતામાન, નાડીના ધબકાર અને શાસનો દર માપવાં :

વ્યક્તિ જ્યારે બિમાર થાય છે ત્યારે તેના શરીરના સામાન્ય જીવનસૂચક નિશાનીઓના માપમાં ફેરફાર થવા માંડે છે. જેમ કે જીવાણુનો ચેપ થાય તો ઉષણતામાન વધે, હદ્યની બિમારી થાય તો નાડીના ધબકાર વધે કે ઘટે, ફેરસામાં બિમારી થાય તો શાસનો દર વધે વગેરે.

દર્દીનું ઉષણતામાન માપવું હોય અને તમારી પાસે તેનું સાધન (થર્મોમીટર) ના હોય તો તમારી હાથની પાછળની ચામડીથી દર્દીના કપાળે અડકી જુઓ. તમને હુંકાળું કે ગરમ લાગે તો તેને તાવ છે એમ ગણાય. થર્મોમીટર હોય તો તેને મોંમાં, બગલમાં કે ગુદામાં મૂકીને ઉષણતામાન માપી શકાય. દર્દીની

## શરીરનું ઉષણતામાન, નાડીના ધબકાર અને જ્વાસનો દર માપવાં

બગલ કરતાં મૌખાં વધુ ઉષણતામાન જણાય છે અને મૌં કરતાં ગુદામાં વધુ ઉષણતામાન હોય છે. થર્મોમીટર પણ બે પ્રકારના હોય છે. સેન્ટીગ્રેડ અને ફેરનહીટ બન્ને માપો ઉષણતામાન માટે વપરાય છે.




ચિત્રમાં મૌઢામાં લેવાયેલ ઉષણતામાન દરાવેલા છે.

### ઉષણતામાન કેવી રીતે લેશો :

1. થર્મોમીટર બરાબર સાબુ અને ઠંડા પાણીથી અથવા સ્પીરીટથી સાફ કરો. તેની ઉપરની કાચની નળી બાજુથી પકડીને ઝટકવાથી પારો (ચાંદી જેવી ચમકતી લીટી)  $36^{\circ}$  સેન્ટીગ્રેડ અથવા  $97^{\circ}$  ફેરનહીટથી નીચે ઉત્તરી જવો જોઈએ.
2. મૌઢામાં થર્મોમીટરનો ચાંદી જેવો ચટકતો ગોળાનો ભાગ જીબની નીચેની ચામડી (અંતઃત્વચા) પર અડકે તેમ ગોઠવો. મોઢું બરાબર બંધ કરો. જે માણસ મોઢું ભીડી હો કે થર્મોમીટર દાંતથી કચડી નાંખશે એવી બીક હોય તો તેની બગલમાં નીચેની ચામડીને અડકાડીને હાથ બરાબર ઢાબીને બંધ કરો ખૂબ નાના બાળકને પ્રથમ વેસેલીન જેવું પ્રવાહી લગાવીને પછી ગુદામાં થર્મોમીટર મૂકો.



3. બે-ત્રણ મીનીટ સુધી એમ જ રહેવા હો. ત્યારબાદ માપ વાંચો.
4. માપ વાંચ્યા પછી થર્મોમીટર બરાબર ધોઈને લૂધીને પારો ઉતારીને મૂકો.



## સ્વાર્થ્ય સંભાળની આવડતો

### નાડી/હદ્દયના ધબકારા :

નાડી જેવાથી હદ્દ્ય ઝડપથી કે ધીમુ ચાલે છે તેની ખબર પડે છે. તાવ આવે ત્યારે દરેક અંશ (સેન્ટીગ્રેડ) માટે હદ્દ્યના ધબકારા ૨૦ જેટલા વધે. પુષ્ટ વયના માણસને એક મીનીટમાં ૬૦-૮૦ ધબકારા થાય છે. વધારે ઝડપથી ચાલતા ધબકારા દર્શાવે છે કે

- દર્દીને લોહી વહી ગયું છે અથવા દર્દી શૉક (shock) માં ગયેલ છે.
- દર્દીને તાવ આવે છે કે ચેપ થયો છે.
- ફેફસાં, શ્વસનતંત્ર કે હદ્દ્યની તકલીફ થઈ છે.
- દર્દીને થાયરોઇટ ગ્રંથીમાં તકલીફ છે.



**શાસનો દર :** શ્વસનદરથી ફેફસાં અને શ્વસનતંત્રની પરિસ્થિતિ ખબર પડે છે. વ્યક્તિની આરોગ્યની સ્થિતિ પણ તેનાથી ખબર પડે છે. શાસ લેતી વખતે કેટલી વાર છાતી ઊંચી થઈને નીચી થાય છે, તેવું એક મીનીટ સુધી જુઓ અને ગણો. પુષ્ટ વયના વ્યક્તિનો શ્વસનદર ૧૨ થી ૨૦ સુધીનો હોય છે. ચેપ થવાથી, તાવ આવવાથી, લોહી વહી જવાથી, નિર્જલીકરણ થવાથી, ફેફસાની બિમારી થવાથી, દર્દી શોકમાં જવાથી કે અન્ય કોઈ કટોકટી વખતે શ્વસનદર ઝડપી બને છે. ખૂબ નબળા માણસનો શાસનો દર અને નાડીના ધબકારા ખૂબ ધીમા પડે તો માની શકાય કે વ્યક્તિનું ભરણ નજીક છે.

પુખ્ત ઉંમરની વ્યક્તિમાં એક મીનીટમાં 30 થી વધુ શ્વસન દર ન્યુમોનીયા અથવા ફેફસાનો ચેપ દર્શાવે છે.

નાના બાળકોમાં ઉંમર પ્રમાણે શ્વસનદર વધારે કે બરાબર કહી શકાય.

નવજાત શિશુ (બે માસથી નાનું બાળક)

૨ માસથી નાનું બાળક ૬૦ થી ઉપર શ્વસન દર હોય તો ન્યુમોનીયા (વરાધ) છે.

૨ માસથી ૧ વર્ષનું બાળક ૫૦ થી ઉપર શ્વસન દર હોય તો ન્યુમોનીયા (વરાધ) છે.

૧ વર્ષથી ૫ વર્ષનું બાળક ૪૦ થી ઉપર શ્વસન દર હોય તો ન્યુમોનીયા (વરાધ) છે.

### ૩.૦ લોહીનું દબાણ અથવા રક્તચાપ (બલડપ્રેશર) :

નસોમાં લોહી કેટલા જેરથી ફરે છે તે માપવાથી ખબર પડે છે કે લોહીનું દબાણ કેટલું છે. બેનોનું લોહી દબાણ નીચેના સંજોગોમાં ખાસ માપવું જોઈએ :



- \* સગર્ભાવસ્થા, બાળજન્મ, કસૂવાવડ કે ગર્ભપાત વખતે
- \* સ્ત્રી જ્યારે ગર્ભ નિયમન માટેની ગોળી લેતી હોય અથવા લેવાનું વિચારતી હોય ત્યારે લોહીનું દબાણ માપવું જોઈએ.
- \* શોક, વધારે પડતો પેટનો દુઃખાવો, મુશ્કેલ બાળજન્મ વખતે પણ લોહીનું દબાણ માપવું જરૂરી છે.

બલડ પ્રેશર - લોહીનું દબાણ માપવા માટે બે આંકડાનો ઉપયોગ થાય છે.

$\frac{120}{80}$  અથવા BP 120/80 એટલે 120 ઉપરનું (સિસ્ટોલિક) માપ છે અને 80 નીચેનું (ડાયસ્ટોલિક) માપ છે.

નોર્મલ (સામાન્ય) બલડ પ્રેશર : પુખ્ત વયના માણસનું બલડપ્રેશર 120/80 ની આસપાસ હોય છે. પરંતુ 90/60 થી 140/85 ની વચ્ચે કોઈ પણ માપ આવે તો તેને પણ નોર્મલ કહી શકાય. નીચેનું માપ દર્દીની હાલત વિશે વધુ ચોક્કસ માહિતી આપે છે. જે કોઈનું દબાણ 140/90 હોય તો ચિંતાજનક નથી પરંતુ 225/110 હોય તો તે ચિંતાનો વિષય છે. નીચેનું માપ 100 થી વધે તો સારવારની જરૂર છે એમ કહેવાય. લોહીનું દબાણ નોર્મલથી ઓછું રહેતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તે વ્યક્તિ લાંબુ જીવશે એમ કહી શકાય. જેમ કે કોઈનું બલડપ્રેશર 90/60 થી 110/70 જેટલું રહેતું હોય તો તે સારી નિશાની છે. તેને હદ્યરોગ થવાની સંભાવના ઓછી છે.

## સ્વારથ્ય સંભાળની આવડતો

### લોહીનું દબાણ અચાનક ઘટવું :

90/60 થી પણ ઓછું દબાણ અચાનક થઈ જય તો તે ગંભીર નિશાની છે. કોઈવાર દર્દીને કાંઈ ના થયું હોય પણ ભૂલમાં ઓછું દબાણ આવે તો ગભરાઈ ન જશો. થોડીવાર પછી ફરી દબાણ માપો. ઘણીવાર જુદા જુદા સમયે વ્યક્તિનું દબાણ માપીને તેમાં થતા ફેરફાર પર નજર રાખવાની જરૂર પડે છે. કેટલાક બેનોને દબાણમાં ફેરફાર મહિને મહિને આવતો હોય છે તે સામાન્ય પણ હોઈ શકે છે અથવા તેમાં ફેરફાર ઉપર ધ્યાન રાખવાથી તે વ્યક્તિની સામાન્ય અને અસામાન્ય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. દા.ત. સગર્ભાવસ્થામાં દબાણમાં ફેરફાર.

### લોહીનું દબાણ કેવી રીતે માપશો ?


દબાણ માપવાનું સાધન બે જાતનું હોય છે. એકમાં ઘડિયાળ જેવો ગોળ ચાંદો આવે છે તો બીજામાં લાંબું થર્મોમીટર જેવું સાધન બોક્સમાં ફીટ કરેલું હોય છે.

દ્રેક સાધન સાથે સ્ટેથોસ્કોપ આવે છે.




### જલડપ્રેશર લેવા માટે નીચે જણાવેલ પદ્ધતિ છે :

1. હાથ પર કોણીથી ઉપરની બાજુએ તેની કોથળી બાંધો.
2. રખરના ગોળા પરનો વાત્વબંધ કરો.



3. કોણીની અંદરની બાજુએ નાડી કરાં છે, તે શોધો તેની પર સ્ટેથોસ્કોપ મૂકો. કોઈકવાર નાડી ના ખબર પડે તો કોણી ગુહાની મધ્યમાં સ્ટેથોસ્કોપનો ચંદો ગોઠવો.



## લોહીનું દબાણ અથવા રક્તચાપ (બિલડપ્રેશર)

૪. રખરના ગોળાને દબાવીને સાધનની કોથળી ફૂલાવો. તેથી હાથમાં લોહીની નજીઓ પર દબાણ થશે.



૫. ગોળાથી હવા પૂરશો એટલે દબાણ-માપકની સોય આગળ વધશે અથવા પારો ઉપર ચઢશે. જ્યારે તે ૨૦૦ ઉપર પહોંચે ત્યારે વધુ કુલાવવાનું બંધ કરો.



૭. વાલ્વ બંધ હશે તો દબાણ માપક ૨૦૦ ઉપર જ સ્થિર રહેશે. વાલ્વ ઢીલો કરવાથી ધીમે ધીમે દબાણ માપકની સોય પાછી ખસશે અથવા પારો નીચે ઉત્તરશે.




હવા જેમ જેમ નીકળતી જશે તેમ તેમ દર્દીની નાડીનો ઘબકાર સંભળાવાનું શકું થશે. જે માપ ઉપર ઘબકાર સંભળાવા માંડે તે માપ નોંધી લેવું. તે ઉપરનું માપ છે અને જ્યારે ઘબકાર સંભળાવાનું બંધ થઈ જય, તે નીચેનું માપ છે. રખરની કોથળીમાંથી હવા એટલી બધી ઓછી થઈ જય કે તે હવે નાડીને દબાવતી નથી તેથી ઘબકાર સંભળાતો નથી. બન્ને માપ નોંધાઈ જય એટલે કોથળીમાંથી બધી હવા કાઢી નાંખો અને હાથ ઉપરથી તેને છોડી લો તથા તેમાંથી હવા કાઢીને સાચવીને મૂકી દો.

તગભગ અહીંથી નાડીનો ઘબકારો સંભળાય છે.

અહીં સુધી કોઈ અવાજ સંભળાતો નથી.

સોય અહીં પહોંચે છે ત્યારે નાડીનો ઘબકારો સંભળાવાનું બંધ થાય છે.



લોહીનું દબાણ ૧૦૦/૭૦ હોય તો આ રીતે નાડીના ઘબકારા સાંભળીને ખબર પડે છે.

## સ્વારદ્ધ્ય સંભાળની આવડતો

### ૪.૦ પેટ અને પેઢની તપાસ

કોઈ પણ સ્વીને પેટમાં દુઃખાવો થતો હોય તો પ્રથમ “પેટનો દુઃખાવો” પ્રકરણમાં આપેલ માહિતી પર ધ્યાન કરો અને પછી પેટ તપાસવાનું શરૂ કરો.

૧. તેના પેટ પરથી કપડું દૂર કરો જેથી છાતી અને ગુહ્યાંગોના વાળ સુધી પેટ બરાબર જેઠ શકાય.
૨. તેને ચત્તા સૂવાનું કહો, ઘૂંઠણેથી પગ વાળવા કહો, જેથી પગની પાની થાપાને અડકી જય, પેટના સ્નાયુ ઢીલા મૂકવા કહો.
૩. તેના પેટ પર કાન મૂકીને પેટની અંદર હવાના પરપોટા કે પ્રવાહી સરકવાના અવાજ સાંભળો. જે બે મિનિટ સુધી કાંઈ ના સંભળાય તો એ એક ગંભીર નિશાની છે.



૪. તેને સૌથી વધુ ક્યાં દુઃખ છે તે પૂછો. પછી તે ભાગ હળવેથી દબાવીને જુઓ ને પછી બીજુ ભાજુ પર અડકો અને તપાસો. તેને પેઢામાં કંઈ જગ્યાનો દુઃખાવો છે તે જાણવાની કોશિશ કરો.
૫. તેનું પેટ પોચું છે કે કઠણ તે ખબર પડશો. તેમાં ગાંઠ જેવું કાંઈ જણાય છે કે કેમ તે પણ તપાસો. દુઃખતા ભાગ પર હાથ રાખવાથી પેટ ઢીલું મૂકી શકે છે કે કેમ તે તપાસો.

૬. તેને આંત્ર પુચ્છનો ચેપ (એપેન્ડિસાઇટીસ), આંતરડાનો ચેપ કે પ્રજનનમાર્ગ/ગર્ભાશયનો ચેપ છે કે નહિ તે જેવા માટે ધીમે રહીને તેના પેઢની ડાબી ભાજુએ જ્યાં પગનો સાંધો થાય છે તેની ભાજુમાં તેને થોડુંક દુઃખ તેટલું દબાવી જુઓ અને પછી એકદમ ઝડપથી છોડી દો. જે દર્દીને સખત દુઃખાવો થાય તો તેની હાલત એકદમ ગંભીર છે. તેને તરત જ દવાખાને લઈ જવ. તેને ઓપરેશન કરવાનું છે તેથી સમય બગાડ્યા વગર મોટા દવાખાને જ લઈ જવી.

જે તેને આવી રીતે તપાસવાથી સખત દુઃખાવો ના થાય તો તેના ગુહ્યાંગ તપાસો. ત્યાં જતીય રોગની કોઈ નિશાની દેખાય છે કે કેમ તેની ચોક્કસાઈ કરો. તમને જે આવડે તો તમે તેના પ્રજનન માર્ગની તપાસ પણ કરી શકો.

#### ૫.૦ સ્ત્રી જનનાંગોની તપાસ

આ તપાસ શીખવાનું અધ્યં નથી. તે આવડે તો તમે સ્ત્રીઓના ઘણા ગંભીર રોગની તપાસ કરી શકો છો. જેમ કે, ટ્યુબમાં (બીજવાહિનીમાં) ગર્ભ રહ્યો હોય તો તે, ગર્ભદ્વારનું કેન્સર, ગર્ભશિય કેન્સર, કેટલાક જતીય રોગો વગેરેની જાણ મળી શકે છે. તેનાથી આરોગ્ય કાર્યકર કેટલાક સમય અને અનુભવ પછી જનનાંગોની બહારથી તપાસ શીખી શકે અને પ્રજનનમાર્ગની અંદરની તપાસ પણ શીખી શકે છે.

**અગત્યનું :** પ્રજનન માર્ગની તપાસ નીચેના સંક્ષેપોમાં ના કરશો.

- \* જ્યારે સ્ત્રીને સગર્ભાવસ્થા દરમ્યાન લોહી પડતું હોય કે તેની પાણીની કોથળી તૂટી ગઈ છે.
- \* સામાન્ય બાળજન્મ કે ગર્ભપાત પછી તરત.

યાદ રાખો કે જેટલીવાર સ્ત્રીની યોનિમાં કોઇ પણ વસ્તુ જય છે તેટલી વાર તેને ચેપ થવાની શક્યતા વધે છે.

#### તપાસ કેવી રીતે કરશો ?


૧. સ્ત્રીને પેસાબ કરી લેવાનું કહો.
૨. તમારા હાથ બરાબર ધૂચો.
૩. તેણે પહેરેલાં કપડાં ઢીલા કરવાનું કહો. પગ ઉપર ચાદર રાખો.
૪. તેને ચત્તા સૂઈ જવાનું કહો અને ઘૂંઠણથી પગ વાળીને રાખવાનું કહો. તેને બરાબર સમજલવો કે તમે શું કરવાના છો.
૫. તેના પ્રજનનમાર્ગમાં તમે જે હાથની આંગળી મૂકવાના છો તે હાથ પર મોજું ચઢાવો.




યાદ રાખો કે જ્યાં તમે આ તપાસ કરવાના છો ત્યાં પૂરતું અજવાળું હોય. જરૂર પડ્યે ટોર્ચનો ઉપયોગ કરો. આ સ્થળે બહારથી કોઇ પણ વ્યક્તિ ડોકિયા ન કરી શકે તેમ ખાનગી રીતે કરો.

**સ્પેક્યુલમથી તપાસ કરવી :**

ગર્ભદ્વાર અને પ્રજનનમાર્ગની પૂરેપૂરી તપાસ કરવા માટે સ્પેક્યુલમ કામનું સાધન છે. તેનાથી તપાસ કરવા માટે નીચેના પગલાં અપનાવો. જે સ્પેક્યુલમ ના હોય તમારી પાસે તો હવે પછી પાના પર આપેલ પગલાં અપનાવો.



1. સ્પેક્યુલમ વાપરતાં પહેલાં તેને જંતુરહિત થયું છે કે નહીં તેની ચોક્કસાઈ કરો. ચોપખા પાણીથી તેને જરા ભીનું કરી લેવું.
2. મોજું પહેરેલ પ્રથમ આંગળી યોનિદ્વારથી અંદર જવા દો. ધીમેથી આંગળીની નીચેના સ્નાયુને દૃબાવતા જાઓ જેથી અંદર બરાબર જેઠી શકાય. ગર્ભદ્વાર સુધી આંગળી જવા દો. તેને સ્પર્શ કરશો તો નાકના ટેરવાને અડતા હોય તેવું જણાશો. વચ્ચે વચ્ચે બેન હળવાશનો અનુભવ કરે તે જરૂરી છે. માટે ખોટી ઉતાવળ કે જેરપૂર્વક કશું ના કરવું.
3. બીજ હાથથી સ્પેક્યુલમની બે પતરીઓને ભેગી રાખીને તમારી બે આંગળીની વચ્ચેથી યોનિમાં જવા દો. જ્યારે સ્પેક્યુલમ અડધું અંદર જય પછી તેને ધીમેથી નીચેની બાજુ ફેરવો, જેથી હેન્ડલ નીચેની તરફ આવે. તમારી આંગળી બહાર ખેંચી લો. ભૂલથી પણ મૂત્રમાર્ગ કે કલાઈટોરીસ પર દૃબાણ ના આવે કારણકે આ બંને અંગો ખૂબ નાજુક હોય છે.
4. ધીમે રહીને સ્પેક્યુલમની બે પતરીઓને ખોલો અને તેની વચ્ચેથી ગર્ભદ્વાર જેવાની કોશિશ કરો. સ્પેક્યુલમનો સ્કુ ટાઇટ કરો જેથી તે એમ જ રહી શકે.
5. ગર્ભદ્વાર ગુલાબી, ગોળ અને નરમ સ્નાયુ જેવું હોય છે. દ્વાર ખુલ્લું છે કે બંધ તે તપાસો. તેમાંથી કોઈ જતનું પ્રવાહી પડે છે કે લોહી પડે છે તેની ખાત્રી કરો. કસૂવાવડ કે ગર્ભપાત પછી અથવા બાળજન્મ પછી સ્વીના ગર્ભદ્વારમાંથી ટૂકડા બહાર આવતા દેખાય છે. લીલું કે પીળું પ્રવાહી દેખાય તો તેને ચેપ છે એમ જણાય. જે સ્વીને પેસાબ કે મળ યોનિમાં દેખાય તો તે યોનિ દિવાલમાં કયાંથી આવે છે તે જેવા માટે સ્પેક્યુલમ બંધ કરીને ફેરવો.
6. સ્પેક્યુલમ થોડું પાછું ખેંચીને બંધ કરતા જવ. સ્પેક્યુલમ ધીમે રહીને બહાર લઈ લો અને તેને તરત જ સાફ કરીને જંતુરહિત કરો.




બહારથી જનનાંગો જુઓ :



મોજું પહેરેલા હાથથી એને સ્પર્શ કરો અને તેને કોઈ પ્રકારની ગાંઠ, ફૂલાવો, જુદી જતનું પ્રવાહી જવું, ચાંદું, ઘા, ચિરા પડચા છે કે કેમ. ભગોષ્ણની ચામડીની વચ્ચેના ભાગને પણ પહોળો કરી બરાબર જુઓ. જતીય રોગની તકલીફ/નિશાનીઓ જનનાંગો પર બહારથી દેખાતી હોય તો તે જુઓ.

પેઢુમાં રહેલા જનનાંગોની તપાસ કેવી રીતે કરશો.

1. સ્વીની યોનિમાં મોજું પહેરેલ હાથની પહેલી આંગળી મૂકો પછી તેનાથી યોનિના સ્નાયુને નીચે દ્વારાવતા જાઓ જેથી તે ઢીલા થાય અને ત્યાર પછી મદ્યા (વચ્ચીની આંગળીને) પણ અંદર લઈ જાઓ હાથ ફેરવીને હથેળી ઉપર આવે તેમ અંદર મૂકો.
2. ગર્ભદ્વારને સ્પર્શ કરીને જુઓ કે એ બરાબર ગોળ અને કઠણ છે કે નહિ. ગર્ભદ્વારની કોઈ પણ બાજુએ આંગળી લઈ જાઓ અને તેને ખસેડવાનો પ્રયત્ન કરો. કોઈ પણ દુઃખાવો થયા વગર તે બાજુએ ખસે છે. જે એમ કરતાં દુઃખાવો થાય તો જણો કે તેને ચેપ લાગેલ છે. જે તેનું ગર્ભદ્વાર પોચું હોય તો તે સગર્ભા છે એમ નક્કી થાય.
3. તેના પેઢુની નીચેની તરફ તમારા બીજી હાથથી દ્વારાવશો તો અંદર રહેલ ગર્ભાશય આગળ પાછળ ખસે છે અને તે ગર્ભદ્વાર પર રાખેલી તમારી આંગળીઓને સ્પર્શ દ્વારા ખબર પડે છે. જે તે ગર્ભદ્વારની સામેની બાજુએ નથી એમ લાગે તો ગર્ભદ્વારને ઊંચું-નીચું કે જરા ખસેડીને એ ક્યાં જણાય છે તે શોધો. જે તે ગર્ભદ્વારની નીચેની બાજુ હોય તો ગર્ભાશય નીચેની તરફ ઝુકેલું છે એમ કહેવાય.
4. એક વાર ગર્ભાશયની ખબર પડે એટલે તે કેવડું છે તેનું સાધારણ માપ કાઢો. તમારી અંદરની આંગળીઓને ગર્ભદ્વારની બે બાજુએ ફેરવતા જાઓ અને પેઢું પર રાખેલ બીજી હાથથી જેતા જાઓ કે તે લીંબુ જેવડો સુંવાળો અને કઠણ સ્નાયુ છે.





## સ્વારથ્ય સંભાળની આવડતો

- \* જે ગર્ભાશય પોચું અને મોટું જણાય તો તે સગર્ભા છે.
- \* જે તે ગઢા જેવું અને સખત છે તો તેને ગર્ભાશયમાં ફાઈબ્રોઇટસ સ્નાયુંતંતુની ગાંઠ છે.
- \* તેને અડકવાથી જે તે દુઃખે તો જાણો કે ગર્ભાશયમાં કે આસપાસનો ચેપ થયો છે.
- \* જે એ સહેલાઈથી ના ખસતું હોય તો તેને જૂના ચેપથી ડ્રાઇ ગયેલા કાપાના ભાગ ને લીધે આવું થાય છે. (પેલ્વીક ઇન્ફ્લેન્સેટરી ડિસ્ક્ઝ)

૫. તેની બીજનલિકા અને બીજનશયને પણ સ્પર્શને જેવાનો પ્રયત્ન કરો. સામાન્ય રીતે તે બદામથી નાનું અને કઠળા હોય છે. પણ જે આ ભાગો તમને મોટા અને પોચા જણાય તો તેને જરૂર ચેપ છે અથવા તો બીજનલિકામાં ગર્ભ સ્થાપન થયેલું છે એમ કહી શકાય. બીજનલિકામાં ગર્ભ રહ્યો હશે તો તેનું માસિક ચક પણ બંધ હશે. આ એક કટોકટી છે માટે તેને તરત જ મોટા દ્વારાને મોકલો. તાત્કાલિક ઓપરેશન કરવું પડે.
૬. આંગળી ફેરવીને યોનિની અંદરની દિવાલ વગેરે તપાસો કોઈ જગ્યાએ ચાંદું કે ચીરો જણાય અથવા તેને પેસાબ કે મળ ટપકવાની તકલીફ હોય તો તે ક્યાંથી આવે છે તે તપાસો.
૭. સ્વીને ખાંસી આવા કહો અથવા સંડાસ કરતી હોય તેમ તેને જેર કરવાનું કહો. જે કોઈ ભાગ યોનિમાર્ગમાં ફૂલી આવતો દેખાય તો તે કદાચ ગર્ભાશય કે મૂત્રાશયનો ખસતો ભાગ છે.
૮. બધી તાપસ પૂરી થઈ જય એટલે આંગળી લઈ લો અને મોજું ઉતારી તેને સાફ કરી જંતુરહિત કરવા મૂકો. તમારો હાથ બરાબર સાબુ અને ચોખ્ખા પાણીથી ધૂઅઓ.

### ૬.૦ દાઝેલાની સારવાર

દાઝેલા ભાગને બરાબર ઠંડો પદવા દો. તેની ઉપર બરફ કે ખૂબ ઠંડું પાણી નાંખ્યા કરો. ઠંડા પાણીમાં બોળેલા પોતા પણ મૂકી શકાય. (દાઝેલા ભાગમાં ચચરાટ ઓછો થઈ જય ત્યાં સુધી ઠંડા પાણીમાં બોળી રાખો.) દાઝેલા ભાગની સારવાર તે કેટલો ગંભીર રીતે અસર પામેલો છે તેની પર આધાર રાખે છે. તેની પર કદીયે તેલ, ધી, ચાની ભૂકી, પાંદડાનો ભૂકો, ધૂળ/રાખોડી વગેરે વસ્તુઓ



ના લગાડશો. ઘા ઢાજવા માટે ખોરાકની પરેળ રાખવાની જરૂર નથી. સામાન્ય પૌષ્ટિક ખોરાક બરાબર લેવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે.

દાજવાથી ત્રણ પ્રકારના ઘા પડે છે.

(૧) ચામડી પર સામાન્ય દાય (પ્રથમ ડીગ્રી) (૨) ચામડી બળે અને ફોલ્લા પડે (દ્વિતીય ડીગ્રી) અને (૩) ચામડી અને સ્નાયુ સુધી બળી જય (તૃતીય ડીગ્રી).

સામાન્ય દાજવું = આમાં ચામડી દાજવાથી તે ભાગ ઘેરા રાતા રંગનો થઈ જય છે અને ચચર્યા કરે છે તેની ઉપર ફોલ્લા પડતા નથી. તે ઠંડો પડવાથી તેની જતે જ મટી જશે. બધું દુઃખે તો એસ્પિરીન કે પેરાસીટિમોલ લેવી.



### ફોલ્લા પડે તેવું દાય ત્યારે

ઠંડુ પડચા પછી ફોલ્લા પડે તો તેને ફોડવા નહિ. તેની અંદર પાણી ભરાયેલું હોય તો તેને સોયથી કે અન્ય રીતે કાઢવાની કોશીશ ના કરશો. પણ જે ફોલ્લો તેની જતે ફૂટી જય, તો જંતુરહિત કરેલી કાતરથી તેની ઉપરથી બળેલી ચામડી કાપી નાંખો તેની નીચેથી ભરેલી ચામડી કે બીજે કચરો હોય તો તેને કાઢી નાંખો. નીચેની તાજી ગુલાબી ચામડી દેખાય ત્યાં સુધી હળવો સાખુ અને ખૂબ ચોખ્ખું પાણી લઈ ઘાની સફાઈ કરો. ચોખ્ખા જંતુરહિત કરેલા પાટાના કપડાને મીઠાવાળા પાણીથી પલાળીને તેની ઉપર મૂકો. દિવસમાં ત્રણવાર આ ડ્રેસિંગ બદલો. જે કાંઈ બળેલું કે ચેપવાળું માંસ કે અન્ય કચરો ઘા પર દેખાય તો તેને પણ દૂર કરતા રહેવું. જરૂર પડચે હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ વાપરી શકાય. ડ્રેસિંગ કરતી વખતે ચોખ્ખા તાજી માંસનો ગુલાબી કલર દેખાય ત્યાં સુધી ઘાને સાફ કરવો જોઈએ. જે ડ્રેસિંગનું કપડું ઘામાં ચોંઠી ગયું હોય તો તેને પહેલાં પલાળી રાખો અને પછી હળવેથી ઉપાડી લેવું. જેર કરીને ખેંચવાથી ઘામાં વધુ નુકશાન થશે.



## સ્વારદ્ધ્ય સંભાળની આવડતો

મીઠાનું પાણી નોર્મલ સેલાઈન બનાવવાની રીત : ૧ ચમચી મીઠું ૧ લીટર પાણીમાં ઓગાળવું. પછી તેમાં ડ્રેસિંગના કાપડને નાંખીને બન્ને વસ્તુને ૨૦ મિનિટ સુધી ઉકાળો ત્યાર બાદ ઠંડુ પાડ્યા પછી તેને દાજેલી ચામડી પર વાપરો.


જે આ ઘામાં ચેપ થશે તો આજુભાજુની ચામડી લાલ અને કઠણ દેખાશે, દુઃખાવો વધશે, ને તાવ આવશે. આવા સંનેગોમાં દર્દીને એમોકિસસિલીન ૨૫૦ મિગ્રા, દિવસમાં ૩ વાર સાત દિવસ માટે આપવી પડે. જે ચેપ ના મેટે તો પછી ડાઇકલોકાસીલીન કે ઇશિશ્રોમાઇસીન ૨૫૦ મિગ્રા. દિવસમાં ૪ વાર, સાત થી હસ દિવસ માટે આપવી. વ્યક્તિને ખૂબ પ્રમાણમાં પ્રવાહી આપો.

૩. ચામડી અને સ્નાયુ બળી ગયા હોય તેવા ઊંડા ઘા : આવા ઘા પરથી બધી ચામડી બળી જય અને નીચેનું માંસ બળીને કાળું પડી ગયું હોય છે. આ ઘા બહુ ગંભીર હોય છે. આવા સમયે ચોખ્ખા પાણીમાં બોળેલું ચોખ્ખયું કંપડું વીટાળીને વ્યક્તિને તરત જ દવાખાને લઈ જય. વ્યક્તિને ખૂબ પ્રવાહી પીવડાવો. જે દવાખાનાની મદદ મળી શકે તેમ ના હોય તો ઉપર મુજબ તેની સારવાર કરો. ઘૂળ અને માઝી વગેરેથી ઘાને બચાવવા માટે પણ ઘાને કપડાથી ઢાંકી રાખો. જરૂર પહુંચે વ્યક્તિને ઠંડી જગાએ મચ્છરદાનીમાં સૂવાડો. જે વ્યક્તિ બેભાન હોય તો તેને ખાંડમીઠાનું પાણી ગુદા વાટે આપો. આવા દાઢી ગયેલા વ્યક્તિને પડેલા ઘા દ્વારા પાણી ઉડી જવાથી નિર્જલીકરણ થઈ શકે છે. માટે તેને જીવનજળ (ખાંડ મીઠાનું પાણી) આપ્યા જ કરો. નિર્જલીકરણથી પેસાબ ઓછો થઈ જય છે કે બંધ થઈ જય છે. માટે ખૂબ જીવનજળ આપો જેથી તેને પેસાબ થવા લાગે અને નિર્જલીકરણની ગંભીર અસરમાંથી તે બચે. આ દર્દીઓ ઘણીવાર નિર્જલીકરણથી મૃત્યુ પામે છે. માટે ખાસ ધ્યાન રાખો.

આ વ્યક્તિને દુઃખાવો દૂર કરવાની અકસીર દવા આપો. બેહોશી દૂર કરવાનો પ્રયત્ન કરો. કેટલીકવાર મીઠાવાળા પાણીથી ઘાને ધોઈએ તો પણ તેનું દર્દ ઓછું થાય છે.

### ૭.૦ બેભાન વ્યક્તિને પ્રવાહી આપવાની રીત

જે કોઈ લીને ખૂબ લોહી વહી જય કે તે વધારે પડતું દાઢી જય તો તે બેભાન બની જય (શૉકમાં જય છે) છે. આવું થાય તો તેને તરત જ ખૂબ પ્રવાહી આપવું પડે. જે તે જગ્યાત હોય તો ખૂબ પાણી પીવડાવ્યા જ કરો. તેને નસ દ્વારા પ્રવાહી ચડાવો. કોઈકવાર કટોકટીના સમયે ગુદા વાટે પણ પાણી ચડાવી શકો છો.



## બેભાન વ્યક્તિને પ્રવાહી આપવાની રીત



---

**સજલીકરણ પ્રવાહી (જીવનજળ)** બનાવવાની રીત : (આ પ્રવાહી શરીરમાંથી વહી ગયેલા પાણીની પૂર્તિ કરે છે.)

આ પ્રવાહીમાં એક કપ કોઈ પણ ફળનો રસ કે નાળિયેરનું પાણી કે કેળાનો માવો નાંખવાથી તેની પોષણક્ષમતા વધે છે અને સ્વાદ પણ સારો થવાથી દર્દીને તે વધારે ભાવે છે.

### ખાંડ-મીઠાની રીત

૧ લિટર ચોપખું પાણી	+	૧ ચમચી મીઠું (સમતલ ભરવી)	અને	૮ ચમચી ખાંડ, (સમતલ ભરવી)
-----------------------	---	-----------------------------	-----	-----------------------------



ખાંડ નાંખતા પહેલાં મીઠાવાળું પાણી આંસુ જેટલું ખારું બનવું જેઠાં.




સજલીકરણ પ્રવાહીને જીવનજળ પણ કહેવામાં આવે છે. કારણકે આ પ્રકારે ખાંડ અને મીઠું બરાબર માત્રામાં મેળવીને બનાવેલું શરબત બાળકને નવજલવન આપે છે. નાના બાળકને ઝાડા થયા હોય ત્યારે દરેક ઝાડા પછી એક નાનો જલાસ આ શરબત પાવાથી તેને નિર્જલીકરણ (ડીહાઇડ્રેશન) થતું નથી અને બાળકની જુંદગી બચી જય છે.

## સ્વાર્થ્ય સંભાળની આવડતો

### તૃષણા ધાન્ય અને મીઠાની રીત


૧ લિટર + ૧ ચમચી મીઠું અને ૮ ચમચી ચોપા કે  
ચોપખું પાણી (સમતલ ભરવી) ઘઉંનો લોટ, (ઇલ્લીને ભરવી)



અનાજમાંથી બનાવેલું સજલીકરણ પ્રવાહી થોડા કલાકમાં બગડી જય છે  
તેથી દર વખતે પીવડાવતા પહેલા તેને ચકાસી લેવું.

### ગુદા વાટે પ્રવાહી ચઢાવવાની રીત :

સાધનો : નસમાં ચડાવવાના પાણીનું પેકેટ અથવા ૬૦૦ મિ.લી.  
પીવાનું પાણી નીચેની બાજુએ ઈયુબ લગાડેલું ચોપખું ડબલું  
(એનીમા કેન) તથા દર્દીની નીચે મુકવા કપડાનો દૂચો.




રીત : (૧) વ્યક્તિને ડાબા પડખે સૂવાડો, તેનું શરીર માથા કરતા  
જરા ઉંચું રહે તો વધુ સારું

(૨) તમારા હાથ ધોઈને પ્રવાહીની કોથળી અથવા ડબલું જરા ઉંચું પકડીને પ્રવાહી ઈયુબમાં છેક છેકે  
સુધી આવવા દો.

(૩) ઈયુબનો છેડો પકડીને તેને દર્દીના શરીરમાં ગુદા વાટે મૂકો (ઈયુબ ગુદામાં ત્રણ-ચાર દંચથી વધુ  
ઉંડે ના જવા દેવી.

(૪) પ્રવાહીની કોથળી કે ડબલાની ઉંચાઈ એટલી ગોઠવો જેથી ગુદામાં જતું પાણી આપોઆપ ભહાર ન નીકળી જય.

(૫) બધું પાણી ચઢાવી દીઘા પછી દર્દીને કહો કે સંડાસની હાજત રોકી રાખે. બધું પાણી ચઢવતાં લગભગ ૨૦ મિનિટ લાગશે. ગુદાવાટે મોટા આંતરડામાં પાણી જવાથી તેને સંડાસ જવાની હાજત લાગે છે. પણ તેને કહો કે તે સહન કરીને થોડીવાર દ્વાબાવી રાખે. થોડીવારમાં તે આપોઆપ શરીર જરૂર કરીને વ્યક્તિ બેબાન હોય તો ટ્યૂબ કાઢી લીધા બાદ તેના થાપા તમે દ્વાબાવીને થોડી વાર પંકડી રાખો.



(૬) ગુદામાં ચઢાવેલું પાણી શરીરમાં શોષાતાં થોડી વાર લાગે છે. આ સમયમાં દર્દીને દ્વાખાને મોકલો. જે દ્વાખાને ના પહોંચી શકે એમ હોય અને હજુ તે બેબાનાવસ્થામાં જ હોય તો એકાંક પછી ફરી બીજું પ્રવાહી ચઢાવો.

10 સે.મી. કે ૪ ઇંચ



ગુદામાં ટ્યૂબનો છેડો આથી વધારે અંદર ના જવો જેઠાં.

#### ૮.૦ ઇંજેક્શન આપવાની રીત

સામાન્ય સંનેગોમાં ઇંજેક્શન આપવાની જરૂર પડતી નથી. ઘણી દ્વાઓ મૌં વાટે આપવાથી બધું સત્તામતી જળવાય છે. પણ કોઈક વાર ઇંજેક્શનથી જીવન બચાવી લેવાય. નીચેના સંનેગોમાં ઇંજેક્શન આપવું પડે.

- \* જ્યારે દ્વા મૌં વડે લેવાય તેવા સ્વરૂપમાં ના મળતી હોય.
- \* જ્યારે વ્યક્તિને સતત ઉલટીઓ થતી હોય અથવા દર્દી દ્વા ગળી ના શકે.
- \* બાળજન્મ કે ગર્ભપાત પછી તરતના કેટલાક ચેપ માટે અથવા ખૂબ લોહી વહી જય ત્યારે.

## સ્વારદ્ધ સંભાળની આવડતો

ઇંજેક્શન જે ખોટી રીતે, ખોટી જગ્યાએ અપાઈ જય કે તેના સાધનો બરાબર જંતુરહિત ન બન્યા હોય ત્યારે આપવામાં આવે તો તે જોખમકારક છે. ઇંજેક્શનથી એચ.આઈ.વી./એઈડ્ર્ઝ અથવા કમળો થઈ શકે છે અથવા તે પાકી જય તો ઘણી તકલીફ થાય છે. તેના સાધનો બરાબર ઉકાયા બાદ સોયને બીજુ કોઈ વસ્તુથી અડકવું નહીં. એક જ વપરાશની સોય-સીરીજ હોય તો તેને વાપરીને ફેંકી દો. ઉકાયા વગરના સોય કે સિરીંજ બીજને ઇંજેક્શન આપવા માટે કદી ના વાપરશો.

### ઇંજેક્શન ક્યાં આપશો :

ઇંજેક્શન સ્નાયુમાં આપી શકાય કે ચામડીની નીચે આપી શકાય. આ પુસ્તકમાં વાપરેલ લગભગ તમામ દવાઓના ઇંજેક્શન સ્નાયુમાં આપવાના છે. સ્નાયુમાં લેવાનું ઇંજેક્શન થાપાના જડા સ્નાયુમાં કે જંધના સ્નાયુમાં કે હાથના ઉપરના ભાગે લેવાના હોય છે.


ઇંજેક્શન થાપામાં કે જંધમાં આપવું વધુ સારુ છે. હાથમાં આપવાનું હોય ત્યારે 2 મિ.લિ. થી વધારે દવા કદી ના મૂકવી જોઈએ. પણ જ્યારે ઇંજેક્શનની દવા

- \* એક ડોઝમાં 2 મિલિ. થી વધુ મૂકવાની હોય (3 મિ.લિ. થી વધુ દવા આપવા માટે બે ઇંજે. મૂકો.)
- \* દવાથી વધુ પ્રમાણમાં દુઃખાવો થવાની શક્યતા હોય કે
- \* દર્દી પાતળા બાંધાની હોય ત્યારે થાપામાં કે જંધ પર જ ઇંજેક્શન મૂકો.

થાપા પર ઇંજેક્શન

ઉપરની તરફ બાબ્ય

બાજુએ મૂકવું.



હાથમાં આપવા માટે હાથની

ઉપલી બાજુએ ખભાના હાડકાથી

બે આંગળી જગા મૂકીને આપો.

તે વખતે સ્નાયુ અક્કડ

ના રહેવો જોઈએ.




ખાસ કરીને નાના બાળકોને જંધ પર  
ઇંજેક્શન આપવાનું હોય છે. જંધની ઉપલી  
તરફ બાબ્ય બાજુએ ઇંજેક્શન મૂકો.

### ઇંજેક્શન મૂકવા માટે સિરીંજ તૈયાર કરવાની રીત :


સિરીંજ તૈયાર કરતા પહેલા તમારા હાથ સાબુ અને પાણીથી બરાબર ધોઈ નાંખો. સિરીંજ ફરી વાપરી શકાય તેવી (કાચની) હોય તો પ્રથમ પગલાથી શડ કરો. એક જ વપરાશની સિરીંજ હોય તો તેનું પેકીંગ ખોલ્યા બાદ બીજી પગલાથી શડ કરો.

## ઇંજેક્શન આપવાની રીત


૧. સોય-સિરીજ વગેરેને છૂટા કરી જરૂરિયાત કરો.




૨. પ્રથમ દઢો સિરીજ નળીમાં નાંખો (છેઠેથી જ પકડવો) સોયને તેના પાચાના છેઠેથી પકડીને સિરીજ પર ચઢાવો.




૩. કેટલીક દવાઓ સીધી વાપરવાની હોય તો મુદ્દા ૪, ૫ અને ૧૦ પ્રમાણે કરો.




૪. દવાની કે ડિસ્ટીલ પાણીની બાટલી સાફ કરો અને તેને ઉપરના ભાગે તોડો.




૫. સિરીજ ભરતી વખતે સોય સીધી દવામાં જ બોળાવી જોઈએ, બીજે કશે અડવી ના જાઈએ.




૬. દવાની બાટલી પરના રખરને સ્પીરીટ વાળા પૂમડાથી લૂધી નાંખો. સ્પીરીટ ના હોય તો ઉકાળેલા પાણીનો ઉપયોગ કરી શકાય.



૭. ઇંજેક્શનનું પાણી સોય-સિરીજની મદદથી દવાની બોટલમાં રહેતા પાવડરમાં નાંખો.



૮. બરાબર હલાવીનાંખો જેથી દવા અને પાવડર બરાબર ભળી જય.



૯. આ પ્રવાહી દવાને સિરીજમાં ભરો.



૧૦. સિરીજમાં રહેતી બધી હવા કાઢી નાંખો. તેમ કરવા માટે સિરીજને ઊભી પકડીને દવાના પ્રવાહીમાં રહેતા કોઈ પરખોટાને ઉપર જવા હો અને પછી દૃષ્ટાથી પ્રવાહીને સોયમાં ચઢાવો જેથી બધી હવા નીકળી જય અને સોય-સિરીજ બન્ને પ્રવાહીથી ભરાઈ જય.




ધ્યાન રાખો કે ઇંજેક્શનની સોય કયાંય અડકે નહીં. સ્પીરીટ કે દવાવાળા પૂમડાને કે કૃપાને પાણ તે ના અડવી જોઈએ. જો એમ થાય તો સોયને ફરી ઉકાળવી જોઈએ.


## સ્વારથ્ય સંભાળની આવડતો

### સ્નાયુમાં ઠંજેકશન આપવાની રીત : (ઇન્ટ્રામ્સ્ક્રુલર અથવા IM)

1. વ્યક્તિને તેના અંગૂઠા સાથે રાખી ઉધા સૂવાનું કહો કે બેસીને હાથ ઢીલો મૂકવાનું કહો.
2. ઠંજેકશન મૂકવાની જગ્યા પસંદ કરો અને તેને સ્પીરીટ અથવા સાબુ + પાણીથી સાફ્ કરી કોરી થવા હો.




3. એક જટકામાં સોય સીધી ચામડીમાંથી ઉંડું ખોસી હો.




4. દવા મૂકતાં પહેલાં સિરીજમાંથી દૃષ્ટાને ધીમે રહીને બહાર ખેંચો. (આખો નીકળી ન જય તેનું ધ્યાન રાખો). આમ કરવાથી સિરીજમાં લોહી આવે તો ઠંજેકશન

બહાર કાઢી લો અને તેની બાજુમાં જ ચોખ્ખી કરેલી ચામડી પર ફરી ઠંજેકશન લગાવો.



5. ફરી ખેંચીને જેઠ લો કે લોહી પાછું આવે છે કે નહીં.

6. સોય દ્વારા દવા સ્નાયુમાં ધીમે ધીમે જવા હો. સોય બહાર કાઢી લો અને ચામડી સાફ્ કરો.



### ચામડીમાં ઠંજેકશન આપવાની રીત : (સબક્રુટેનીયસ)

- \* હાથના ઉપલા ભાગમાં નીચે તરફ રહેલ ચરબીવાળો ભાગ પકડો અને ચામડીને હાથમાં આ રીતે પકડો.
- \* સોયને આડી રાખી ચામડીમાં જ રહે તેમ ઠંજેકશનથી દવા મૂકો. તેમ કરતા સોય સ્નાયુમાં ના જતી રહે તેનું ધ્યાન રાખવું.



#### ૬.૦ એલર્જ રીએક્શન કે શૉકની સારવાર કરવાની રીત

દવા લીધાની ૩૦ મિનિટમાં જ જે દર્દીને ચામડી પર ચાઠા ઉપસી આવે, જીણી ફોલ્ટી જેવું થઈ જય કે ખૂબ ખંજવાળ આવે કે શાસ ચડવા માંડે તો દર્દીને એલર્જ રીએક્શન આવ્યું એમ કહેવાય. કેટલીક વાર તેમાંથી દર્દી બેભાન થઈ જય (શૉકમાં જય) તો તેને તાત્કાલિક સારવાર આપવી પડે નહીં તો કયારેક મરી પણ જય. માટે રીએક્શનની સારવાર આપનારી દવાઓ હંમેશા તૈયાર રાખો.

**સાધારણ રીએક્શન :** ખંજવાળ આવે, છીકો આવે, લાલ ચાઢાં થાય. સારવાર માટે ડાઇફીનહાઇડ્રોમાઇન ૨૫ મિ.ગ્રા. ની ગોળી દિવસમાં ઉ વાર અથવા ચિહ્નો બેસી જય ત્યાં સુધી આપો.

**થોડું અથવા વધુ રીએક્શન :** ખંજવાળ આવે, મોકું ફૂલી જય, જુબ જાડી થતી હોય એવી લાગે, ચાઢાં થાય અને શાસ ચડે.

**સારવાર :** ચામડીમાં એપિનેફીન (૦.૫ મિટ્રા.) નું ઠંજેક્ષન આપો. ૨૦ મિનિટ પછી બીજું આપો. ત્યાર પછી ડાઇફીનહાઇડ્રોમાઇન ૨૫ મિટ્રા ગોળી અથવા ઠંજેક્ષન સ્નાયુમાં આપો. ૮ કલાક પછી ૪૩૨ પડે ફરીથી આપો.

રીએક્શન આવ્યા બાદ ૪ કલાક સુધી દર્દીનું બરાબર ધ્યાન રાખો.

**એલર્જ શૉક (ગંભીર રીએક્શન) :**

- \* ખંજવાળ કે ચાઢાં થાય \* મોકું અને જુબ સૂજ જય \* શાસ ચડે પરસેવો વળે.
- \* ચામડી ઠંડી પડી જય \* નબળી છતાં ઝડપી નાડી (૧૦૦ થી વધુ પ્રતિ મિનિટ)
- \* બેભાનાવસ્થા આવે.

**સારવાર :**

૧. એપિનેફીન (૦.૫ મિ.ગ્રા.) ચામડીમાં આપો. ૨૦ મિનિટ પછી ફરી આપો.
૨. ડાઇફીનહાઇડ્રોમાઇન (૫૦ મિ.ગ્રા.) કે પ્રોમીથાજીનનું ઠંજેક્ષન સ્નાયુમાં આપો અને ૪૩૨ પડે તો આઠ કલાકે ફરી આપો.
૩. ૫૦૦ મિ.ગ્રા. હાઇડ્રોકોટીઝોન સ્નાયુમાં આપો અને ચાર કલાક પછી ફરી આપો અથવા ૨૦ મિ.ગ્રા. ડેક્સામિથાજોન સ્નાયુમાં આપો. ૪૩૨ પડે ૪ કલાક પછી ફરી આપો.
૪. દર્દીનું ૮ થી ૧૨ કલાક સુધી ધ્યાન રાખો. તેને જે ફરી ચિહ્નો આવવા શરૂ થાય તો ૫૦૦ મિટ્રા. કે ૧૦૦૦ મિ.ગ્રા. હાઇડ્રોકોટીઝોનનું ઠંજેક્ષન આપવું. ૪૩૨ પડે ૪ કલાક પછી ફરી આપો અથવા ડેક્સામિથાજોન ૨૦ મિટ્રા. આપો. ૪૩૨ પડે તો ૪ કલાક પછી ફરી આપો. દર્દી ભાનમાં આવે પછી તેને સ્ટીરોઇડની ગોળીઓ લેવાનું કહો.

**નોંધ :** એલર્જ રીએક્શન જે વધારે આવે કે ગંભીર સ્વરૂપમાં હોય તો મોકું કર્યા વગર દર્દીને દવાખાને પહોંચાડો. એલર્જ શૉકની સારવાર બરાબર કરવામાં ના આવે તો દર્દીનું મરણ પણ થઈ શકે. માટે તેને જલ્દીથી દવાખાને લઈ જરૂરી છે.

સ્વારદ્ધ્ય સંભાળની આવડતો

---

